

બ્રેમ્પટનમાં રોજર્સ સાઈબર સિક્યોર કેટાલિસ્ટ માટે \$30 મિલિયનનું રોકાણ થવાનું છે

બીજી એક પરિવર્તનલક્ષી પહેલ આ શહેરની સ્થિતિને નવીન શોધના કોરિડોર પર સ્થાપે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 14, 2019) – આજે, મેયર પેટ્રિક બ્રાઉને (Patrick Brown), બ્રેમ્પટન સીટી કાઉન્સિલ વતી, ગવર્નમેન્ટ ઓફ કેનેડા દ્વારા સાઈબર સિક્યોર કેટાલિસ્ટમાં નોંધપાત્ર રોકાણને આવકારવામાં આવ્યું, જે આપણું શહેર, રોયલ બેંક ઓફ કેનેડા અને રોજર્સ કોમ્યુનિકેશન્સ ઈન્ક. સાથેની ભાગીદારીમાં રાયરસન યુનિવર્સિટીની આગેવાનીમાં એક પહેલ છે.

માનનીય નવદીપ બેઈન્સ (Navdeep Bains), ઈનોવેશન મિનિસ્ટર, વિજ્ઞાન અને આર્થિક વિકાસ દ્વારા ડાઉનટાઉન બ્રેમ્પટનમાં રોજર્સ સાઈબર સિક્યોર કેટાલિસ્ટની સ્થાપના કરવા \$10 મિલિયનના ભંડોળની ઘોષણા કરવામાં આવી. રોજર્સ કમ્યુનિકેશન્સે \$10 મિલિયન આપવાનું વચન આપ્યું છે, સીટી ઓફ બ્રેમ્પટને આગામી પાંચ ઉપરાંત વર્ષોમાં \$5 મિલિયન આપવાની અને રોયલ બેંક ઓફ કેનેડાએ આ પહેલ પ્રત્યે બીજા \$5 મિલિયન આપવાની કટિબદ્ધતા દેખાડી છે.

આ રોમાંચક વિકાસ એ બ્રેમ્પટનને શિક્ષણ અને નવીન શોધ માટેનું નિર્ધારિત લક્ષ્ય બનાવવા, રાયરસન યુનિવર્સિટી અને આપણું શહેર વચ્ચે અવિરત સહયોગનું પરિણામ છે. આ વર્ષે નવેમ્બર સુધીમાં બ્રેમ્પટન સીટી હોલમાં ખુલવા નિર્ધારિત, રોજર્સ સાઈબર સિક્યોર કેટાલિસ્ટ હાલના સાઈબર સુરક્ષા વ્યવસાયિકોની કુશળતા વધારવા પર અને આ શહેરમાં, અને સમગ્ર ઓન્ટેરિયો અને કેનેડામાં સાઈબર સુરક્ષા કંપનીઓને સહાયતા કરવા પર ધ્યાન આપશે. રાયરસન યુનિવર્સિટી બ્રેમ્પટન સીટી હોલમાં પોતાની યાંગ સ્કૂલ ઓફ કન્ટિન્યુઈંગ એજ્યુકેશન મારફતે સાઈબર સુરક્ષા અભ્યાસક્રમો પણ આપી રહ્યું છે.

આ ઘોષણા ડાઉનટાઉન બ્રેમ્પટનમાં અન્ય મોટા તાજેતરના રોકાણો પછી થઈ છે. મે મહિનામાં, બ્રેમ્પટન [સીટી કાઉન્સિલે ત્રણ પરિવર્તનલક્ષી પહેલોને મંજૂરી આપી](#), જેમાં સેન્ટર ફોર ઈનોવેશન, ડાઉનટાઉન ટ્રાન્ઝિટ ટર્મિનલ અને હ્યુરોન્ટેરિયો મેઈન લાઈટ રેઈલ ટ્રાન્ઝિટ સામેલ છે.

અવતરણો (ક્વોટ્સ):

“અમે આપણાં વર્ષ 2040 નાં લક્ષ્યના ભાગ તરીકે આ શહેરને તકો આપતું શહેર બનાવવા કાર્યરત છીએ ત્યારે, હું રાયરસન યુનિવર્સિટીની આગેવાનીમાં રોજર્સ સાઈબર સિક્યોર કેટાલિસ્ટને સહાયતા કરવા માટે અને બ્રેમ્પટનમાં નેશનલ સેન્ટર ફોર સાઈબર સિક્યુરિટી સ્થાપવા માટે, ગવર્નમેન્ટ ઓફ કેનેડા, રોજર્સ એન્ડ રોયલ બેંક ઓફ કેનેડાનો આભાર માનવા ઈચ્છું છું. અમે ડાઉનટાઉનમાં સંભવિત પરિણામો ખોલવા અને આર્થિક વિકાસ અને નોકરીઓને અગ્રતા આપવા પ્રયત્નશીલ છીએ. આ સહયોગ સાહસ વડે અમારો હેતુ આપણી પાસે એ પ્રતિભાઓ, સંસાધનો અને સંશોધન હોવાનો છે જે સાઈબર સુરક્ષાની વિકસી રહેલી વૈશ્વિક ધાકની વધતી માગ સંતોષવાની ખાતરી કરાવે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

“અમે બ્રેમ્પટનમાં રોજર્સ સાઈબર સિક્યોર કેટાલિસ્ટની સ્થાપના કરવામાં રોમાંચ અનુભવીએ છીએ, અને અમે મેયર, સીટી કાઉન્સિલ અને શહેરના કર્મચારીઓના સહયોગ અને સહાયતા બદલ તેઓના આભારી છીએ. બ્રેમ્પટન નવીન શોધ અને ટેકનોલોજી વિકાસ માટે મહત્વનું કેન્દ્ર છે, અને આપણાં શહેરને સાઈબર સિક્યોર કેટાલિસ્ટ નવીન શીધ અને સહયોગ માટે કેનેડાનું કેન્દ્ર (હબ) બનાવવા અમે બ્રેમ્પટનના ધંધાકીય સમુદાય, પોસ્ટ-સેકન્ડરી ઈન્સ્ટિટ્યુશન્સ અને રહેવાસીઓ સાથે ધનિષ્ઠપણે કામ કરવા આશાવાદી છીએ.”

- ચાર્લ્સ ફિનલે (Charles Finlay), એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર, સાઈબર સિક્યોર કેટાલિસ્ટ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને ત્યાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ટુગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca